

17 એપ્રિલ 2018

હવામાન વિષયક કોઈ ઘટના દરમિયાન સીટી ઓફ બ્રામ્પટનની કામગીરીઓ પર અપડેટ

બ્રામ્પટન, ON: ગત અઠવાડિયાને છેડે બ્રામ્પટન સહિત મોટા ભાગના દક્ષીણી ઓન્ટારિયો અભૂતપૂર્વ વાસંતી વાવાઝોડાનું શિકાર બન્યું. સીટી કુના સદસ્યો અને બ્રામ્પટનના નિવાસીઓ માટે આંશિક ઓગળી ગયેલ બરફ (સ્લીટ), બરફના કરા, થીજ દેતો વરસાદ અને વરસાદનું સંયોજન પડકારરૂપ બન્યું.

આજે મોરેથી (મંગળવાર), તમામ ઉપલબ્ધ સંસાધનો રહેઠાણ ધરાવતા માર્ગો પર મીઠું નાંખવા કામે લગાવી દેવાશે જેથી બરફ અને બરફની સપાટીઓ પીગળી શકે. અપેક્ષા રાખવામાં આવે છે કે તમામ માર્ગો પર આવતી કાલ સુધીમાં મીઠાનો છંટકાવ કરી દેવાશે.

સીટીએ કેટલાક સાઈડવોક ટ્રેક્ટરો પણ સેવામાં લીધા છે અને તેના આગમનની રાહ જોવાઈ રહી છે જેથી વ્યુહાત્મક સ્થળો પર તેને કાર્યરત કરી શકાય.

ઘણા નિવાસીઓ પૂછી રહ્યા છે કે સીટીએ રહેઠાણવાળા માર્ગોને પ્લો કેમ નહીં કર્યા. એના બે કારણો છે:

- સોમવારે જ્યારે ઈન્વાયરન્મન્ટ કેનેડા દ્વારા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી અને સ્થાનિક સંરક્ષણ સત્તાવાળાએ ફ્લડ વોચ જારી કર્યા ત્યારે એવું નિર્ધારણ થયું કે રહેઠાણના માર્ગો પ્લો કરાશે તો કેચ બેસિનો એટલે કે ગટર પ્રણાલિઓ બરફ અને હિમથી અવરોધાઈ શકે જેને કારણે પૂરનું જોખમ વધી શકે.
- મોટા ભાગની નગરપાલિકાઓની જેમ જ બ્રામ્પટનની મોટા ભાગની શિયાળું કામગીરીઓ કોન્ટ્રાક્ટ દ્વારા થાય છે. માર્ચના અંતે જ્યારે કોન્ટ્રાક્ટ સમાપ્ત થાય ત્યારે મોટા ભાગના ઠેકેદારોએ પોતાના સાધનો અને ઓપરેટરોને બાંધકામ ઋતુ માટે પુનઃવિતરિત કરી દીધા હોય છે.
- આ વાવાઝોડું દીર્ઘકાળ સુધી ચાલુ રહેવાને કારણે – અને તે ધ્યાનમાં રાખતા કે ફક્ત મીઠાના છંટકાવની સરખામણીએ પ્લો કરવાની કામગીરીને ત્રણ ઘણો વધુ સમય લાગતો હોય છે – કુના સદસ્યોએ વ્યુહાત્મક રીતે કાર્ય કરવું પડ્યું હતું. અઠવાડિયાને છેડે, તેનો અર્થ એ થયો કે મુખ્ય માર્ગો પર પ્લો કરવાની કામગીરી અને મીઠાના છંટકાવની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. સોમવારે જ્યારે તાપમાન વધવાની શરૂઆત થઈ, એટલે મુખ્ય માર્ગોની સફાઈ ચાલુ રાખવા સાથે પૂર નિવારણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ થયું.

સીટીના કુ સદસ્યોએ વાવાઝોડાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી જેમાં સામેલ છે:

- ઈન્વાયરન્મન્ટ કેનેડાની હવામાન આગાહીઓ પર દેખરેખ રાખવી
- જે ઠેકેદારોનો સમય સમાપ્ત થયો હતો તેમનો સંપર્ક સાધી તે નિર્ધારિત કરવું કે તેઓ કેટલા સંસાધનો પૂરા પાડી શકે; કમનસીબે, સામાન્ય પણે કોન્ટ્રાક્ટમાં રહે તેના કરતા 50 ટકા કરતા ઓછા ઘટક ઉપલબ્ધ હતાં.

- તે સુનિશ્ચિત કરવું કે પર્યાપ્ત માત્રામાં મીઠાની સામગ્રીનો સંગ્રહ થયો હોય
- ઉપલબ્ધ સંસાધનોના આધારે એક્શન પ્લાન બનાવવો

આ કામગીરીઓ ચાલુ હોય ત્યારે તેમના સહયોગ માટે સીટી ઓફ બ્રામ્પટન શહેરીજનોનો આભાર માને છે. કુના સદસ્યોની હવામાન આગાહીઓ અને માર્ગની પરિસ્થિતિઓ પર દેખરેખ રાખવી ચાલુ છે.

ચાલુ રહેલ અપડેટ્સ માટે, કૃપા કરીને સીટી ઓફ બ્રામ્પટનને ટ્વિટર અને ફેસબુક અને www.brampton.ca/snow પર ફોલો કરો. જો તમે 311 ને કોલ કરવાનો પ્રયાસ કરતા હોવ તો તમને જાણ થશે કે તેઓ હાલમાં બહુ ઉચ્ચ કોલ વોલ્યુમનો સામનો કરી રહ્યા છે અને સામાન્ય કરતા વધુ પ્રતિક્ષાનો સમય લાગી રહ્યો છે. સર્વિસ રિક્વેસ્ટ રજૂ કરવા માટે તમે 311@brampton.ca ને ઈમેલ પણ કરી શકો છો અથવા service.brampton.ca/service-requests/report-snow-issues. પર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

-30

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca